

સપ્ટેમ્બર 17, 2018

## સીટી ઓફ બ્રામ્પટનના વર્ષ 2018-2020 નાં બજેટને (અંદાજપત્રને) ટોપ એવોર્ડ મળ્યો

બ્રામ્પટન, ઓન્ટેરિયો: [સીટી ઓફ બ્રામ્પટનના મંજૂર કરેલા સંચાલન અને મૂડી અંદાજપત્રો \(ઓપરેટિંગ એન્ડ કેપિટલ બજેટ્સ\) 2018-2020](#)ને ગવર્નમેન્ટ ફાઇનાન્સ ઓફિસર્સ એસોસિએશન ઓફ ધી યુનાઇટેડ સ્ટેટ્સ એન્ડ કેનેડા (GFOA) પાસેથી પ્રતિષ્ઠિત બજેટ પ્રેઝન્ટેશન એવોર્ડ મળ્યો છે.

આ સરકારી અંદાજો બનાવવામાં GFOA ની ઉચ્ચતમ સ્તરીય ઓળખ છે. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે આ શહેરે એવોર્ડ માટે અરજી કરી હોય અને એવોર્ડ મળ્યો હોય અને તે નાણાકીય પારદર્શકતા અને સારી શાસન વ્યવસ્થામાં નોંધપાત્ર ઉપલબ્ધિને પ્રતિબિંબિત કરે છે.

આ એવોર્ડ મેળવવા દરખાસ્ત રજૂ કરવામાં, આ શહેરે અસરકારક અંદાજ રજૂઆત માટે રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત માર્ગરેખાઓ સંતોષવી પડી હતી. આ અંદાજપત્રનું આયોજન એક પોલિસી દસ્તાવેજ, નાણાકીય આયોજન, સંચાલન માર્ગદર્શિકા અને સંચાર વ્યવસ્થા તરીકે કેટલું સારી રીતે થાય છે તેનું મૂલ્યાંકન આ માર્ગરેખાઓ કરે છે.

### અવતરણો (ક્વોટ્સ):

“પ્રતિષ્ઠિત અંદાજપત્ર રજૂઆત (બજેટ પ્રેઝન્ટેશન) માટે પ્રખ્યાત એવોર્ડ મેળવવો એ પારદર્શકતા પ્રત્યે અમારી કટિબદ્ધતાની અને બ્રામ્પટનના ભવિષ્ય માટે આયોજન કરવામાં દૃષ્ટેશીપણું દેખાડતી અન્ય એક ઘોષણા છે. કેનેડાના સૌથી જુવાન અને સૌથી વૈવિધ્યસભર શહેરોમાંના એક તરીકે, બ્રામ્પટનનું અંદાજપત્ર 2018-2020 જીવનની ગુણવત્તા સુધારવા પર અને વધારે સુદૃઢ આર્થિક સંભાવનાઓ અને વૃદ્ધિ માટે યાવીરૂપ વ્યૂહાત્મક અગ્રતાઓમાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.”

મેયર લિન્ડા જેફ્રી (Linda Jeffrey)

“અમે અમારા સહયોગનું આધુનિકીકરણ કરવા પર અને અમારા રહેવાસીઓને વધારે કાર્યક્ષમ રીતે સેવા આપવા અમે જે રીતે કામ કરીએ છીએ તેને વધારવા અચળ રહીએ છીએ. અમારી નાણાકીય ફરજો પ્રત્યે અમારી કટિબદ્ધતા ઉપરાંત, જાહેર સૂચનો અને પારદર્શકતા અમારી અંદાજપત્ર પ્રક્રિયાના યાવીરૂપ ચાલક પરિબલો હતા. અમે સમગ્ર સીટી ઓફ બ્રામ્પટનમાં અમારા સંચાલનો માટે ઉત્કૃષ્ટતા હાસલ કરવાનું ચાલુ રાખીશું.”

હેરી શ્લાન્ગ, (Harry Schlange), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (CAO)

-30-

બ્રામ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રામ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

### મિડિયા સંપર્ક :

બ્રાયન સ્ટિટલ (Brian Stittle)

સીનિયર મીડિયા કોર્ડિનેટર

સીટી ઓફ બ્રામ્પટન

905.874.2143 | [brian.stittle@brampton.ca](mailto:brian.stittle@brampton.ca)